

Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad

Term-End Examination: January-2026

Course Name : MCOM

Subject Name : નાણાકીય સેવાઓમાં માર્કેટિંગ

Subject Code : MC04EC405

Date : 08-03-2026

Time : 11:30AM TO 01:45PM

Max Marks : 70

પ્રશ્ન-1. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(14)

- (1) NSDL અને CDSL વિશે વિસ્તૃત ચર્ચા કરો.
- (2) ક્રેડિટ રેટિંગના ફાયદાઓ સમજાવો.

પ્રશ્ન-2. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(14)

- (1) કાર્યાત્મક ભાડાપટ્ટા વિશે નોંધ લખો.
- (2) કિંમતના પ્રકારો સવિસ્તાર સમજાવો.

પ્રશ્ન-3. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(14)

- (1) નાણાકીય સેવાઓમાં સુધારા અંગેના ઉપચારાત્મક પગલા વર્ણવો.
- (2) નાણાકીય સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય સેવાઓ વિશે વર્ણવો.

પ્રશ્ન-4. નીચેનામાંથી કોઇપણ એક પ્રશ્નનો જવાબ આપો.

(14)

- (1) ફેક્ટરિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા વિગતવાર કરો.
- (2) ભાડા ખરીદ પદ્ધતિના લક્ષણો સમજાવો.

પ્રશ્ન-5. ટૂંકનોંધ લખો (કોઇપણ ત્રણ)

(09)

- (1) નાણાકીય સેવાબજારમાં થતા અપરાધ વિશે જણાવો.
- (2) અભિવૃદ્ધિના પ્રકારો
- (3) નાણાકીય બજારનો ખ્યાલ
- (4) ફોરફીટીંગ એટલે શું? ફોરફીટીંગ ગોઠવણીની વિશેષતાઓ
- (5) ડિપોઝીટરી વ્યવસ્થાના ફાયદાઓ

પ્રશ્ન-6. સાચો વિકલ્પ પસંદ કરો.

(05)

(1) વર્ષ 1969માં ભારત સરકારે કેટલી બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું?

- A) 14
- B) 15
- C) 16
- D) ઉપરમાંથી એક પણ નહીં

(2) નેશનલ હાઉસિંગ બેંક એ _____ ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે.

- A) HDFC
- B) HSBC
- C) RBI
- D) HUDCO

(3) IT Act, 2000માં ક્યારે સુધારો કરવામાં આવ્યો?

- A) 2008
- B) 2009
- C) 2007
- D) 2005

(4) કિંમત નિર્ધારણ નીતિને અસર કરતા પરિબળો નીચેનામાંથી કયા છે?

- A) ઉદ્દેશ
- B) બજારના લક્ષણો
- C) ઉત્પાદન ખર્ચ
- D) ઉપરના બધા જ

(5) _____ એ ભારતની પ્રથમ વિકસિત નાણાકીય સંસ્થા છે.

- A) IDBI
- B) ICICI
- C) IFCI
- D) RBI
